

॥ ણમોત્થુ ણ સમણસ્સ ભાવઓ મહાવીરસ્સ ॥  
॥ આયઓ ગુરુબહુમાણો ॥



The Search of the self  
A Total Meditation Retreat Camp

ધ્યાન શિબિર પ્રસ્તુતિ  
સુખ-શાંતિના દરેક મુસાફરની મંજિલ  
વિશ્વના દરેક માનવના લાભાર્થે પ્રભુએ આપેલી પ્રસાદી

પ્રિયમુ

અહો શુતમ्  
શા. બાબુલાલ સરેમલજી  
સિદ્ધાયલ બંગલોઝ, હૃદા જૈન સોસાયટી,  
સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મો. ૯૪૨૬૫૮૫૮૦૪  
ahoshrut.bs@gmail.com

પુસ્તકનું નામ	: આત્મેધણા
લેખક	: પ્રિયમ્
પ્રકાશક	: શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન શાનભંડાર
ભાષા	: ગુજરાતી
વિષય	: ધ્યાન શિબિર પ્રસ્તુતિ
પ્રકાશન વર્ષ	: સંવત્ 2075 ઈ.સ. 2019
પૃષ્ઠ	: 40
આવૃત્તિ	: બીજી
કિંમત	: રૂ. 50/-

## ● પ્રાપ્તિ સ્થાન ●

### શાહ બાબુલાલ સરેમલજી

શા. સરેમલ જવેરચંદ ફાઇનાફેબ(પ્રા.)લી.

672/11, બોંઘે માર્કેટ, રેલ્વેપુરા,

અમદાવાદ-380002

ફોન : 22132543

### જ્ઞાનની બારી

G-1, લાલ કોમ્પ્લેક્સ,

સત્તર તાલુકા સોસાયટી, નવજીવન,

ઈન્કમટેક્સ, અમદાવાદ-380014

ફોન : 9408371206

શ્રી કુલીનભાઈ કે. શાહ

શ્રી આદિનાથ મેડીસીન

TU-02, શંખેશ્વર કોમ્પ્લેક્સ,

કૈલાશનગર, સુરત

મો. 9574696000

શ્રી અક્ષયભાઈ

અર્હમ ઓન્ટરપ્રાઇઝ

20/48, જ્યમહલ બિલ્ડીંગ, રૂમનં. 7-A,

બીજે માળે, બાદશાહ કોલ્ડ્રીન્ક્સ પાસે,

લુહાર ચાલ, મુંબઈ -400002

મો. 9594555505 (whatapps)

For online purchase :

Send Message/whatapps on

(M) 9909866145

Email : jitaryaprint@gmail.com

Email : gyannibaari@gmail.com

Website : gyannibaari.com

## ✿ અર્થમેણુસ - Why & What ✿

**આત્મૈષાણા**

એ ભગવાન શ્રી મહાવીરસ્વામીએ સ્વયં આચરીને  
સમગ્ર વિશ્વના કલ્યાણ માટે  
ઉપદેશોલી ભીતરી યાત્રાની પ્રક્રિયા છે.

સમ્યગ્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યકચારિત્રના ત્રિવેણી સંગમ દ્વારા  
આત્મૈષાણાની આ પ્રક્રિયા સાકાર થાય છે.

જે સદાચાર, સદ્જ્ઞાન અને સદ્ધ્યાન  
આ ત્રિવેણી સંગમની આધાર સ્તંભ બની રહે છે.  
આજે પણ આગમોમાં પ્રભુનો આ ઉપદેશ  
યથાવત્ પ્રામ થાય છે.

**ચરેજડત્તગવેસએ**

તું સતત આત્મૈષાણા કરતો રહેજે.

**સહિએ આયગવેસએ**

જે આત્મૈષાણા કરે છે તે પોતાના આત્માનું હિત કરે છે.

- પરમ પાવન શ્રી ઉત્તરાધ્યયન આગમ.

આત્મૈષાણાનો અર્થ છે સ્વની શોધ.

જ્યાં સુધી આપણે સ્વની શોધ નથી કરી  
ત્યાં સુધી આપણું જીવન વ્યર્थ છે.  
ત્યાં સુધી આપણે આપણા જીવનનો  
ફક્ત વેડફાટ કર્યો છે.

એક વાર જો સ્વની શોધ થઈ જાય  
તો બીજું કશું જ શોધવાનું બાકી રહેતું નથી.



## \* અર્થમેઘહર્ષ - The Search of The Self \*

આત્મૈષણું॥

એ કોઈ નવી ખોજ નથી.

અનાદિ કાળથી આત્માર્થી સાધકો

આ પદ્ધતિના માધ્યમે સ્વની શોધ કરવામાં

સફળ બનતા રહ્યા છે.

અનાદિકાળમાં કોઈ પણ આત્મા

સાચું સુખ, સાચી શાંતિ અને સાચો આનંદ પામ્યો હોય,

તો એ આત્મૈષણાના માધ્યમે જ.

મોટા ભાગના જીવો ‘આત્મા’ને જ્ઞાણતા જ નથી.

જેઓ આત્માને જાણો છે

તેમનો પણ મોટો ભાગ આત્માની શોધને સમજતો નથી.

આત્માની શોધને સમજે છે

તેમનો મોટો ભાગ

જીવનભર આત્માની શોધ કરવાની તક પામી શકતો નથી.

અહીં પ્રસ્તુત છે

એ તક.

આપ ખૂબ જ ભાગ્યશાળી છો

કે આપ એની આટલી સમીપ આવી પહુંચ્યા છો.



## \* અરાટપ્રેષણ - PRINCIPALS \*

ભગવાન શ્રી મહાવીરસ્વામીએ  
આત્મૈષણાનો રાજમાર્ગ બતાવ્યો છે - સર્વવિરતિ.  
અર્થાત् શ્રમણધર્મ.

અનું આચરણ જે ન કરી શકે  
તેના માટે બતાવ્યો બીજો માર્ગ - દેશવિરતિ.  
એટલે કે શ્રાવક ધર્મ.

સર્વવિરતિમાં એક જ વિકલ્પ હોય છે.  
દેશવિરતિમાં હજારો વિકલ્પ હોય છે.  
શ્રાવકવ્રતભંગ પ્રકરણ નામના શાસ્ત્રમાં  
આ તત્ત્વ વિસ્તારથી સમજાવેલું છે.

વિવક્ષિત ‘આત્મૈષણા’ ધ્યાન શિબિરમાં  
કમ સે કમ દશ દિવસની દેશવિરતિ આવશ્યક છે.  
જેની અંતર્ગત દરેક શિબિરાર્થીએ  
જિનવંદનના મંગલપૂર્વક પાંચ આણુક્રત લેવાના રહેશે  
અને કમ સે કમ દશ દિવસની શિબિર દરમિયાન  
તેનું પાલન કરવાનું રહેશે.  
**આણુક્રતો**

- (૧) ગ્રાણતિપાતવિરમણ - કોઈ પણ ત્રસ = હાલતા-ચાલતા  
જીવને જાણી જોઈને મારવો નહીં, સ્થાવર = પૃથ્વી-પાણી  
વગેરે જીવોની પણ નિર્થક હિંસા ન કરવી.
- (૨) મૃષાવાદ વિરમણ = જુદું બોલવું નહીં.



- (૩) અદ્દતાદાનવિરમણ = ચોરી કરવી નહીં. કોઈની વસ્તુ વાપરવી નહીં.
- (૪) મૈથુન વિરમણ = બ્રહ્મયર્થનું પાલન કરવું. વિકાર જન્માવે તેવી મન-વચન-કાયાની પ્રવૃત્તિનો ત્યાગ કરવો.
- (૫) પરિગ્રહ વિરમણ = પૈસા વગેરે માલ-મિલકતનું પરિમાણ (લિમિટ) નક્કી કરવું. બિનજરૂરી સંગ્રહનો ત્યાગ કરવો.



આણુક્રતોની વિશુદ્ધ પાલના ધ્યાનસિદ્ધ માટે ખૂબ જ જરૂરી છે. આ વિશુદ્ધ પાલના માટે શિબિરમાં અમુક વિશેષ નિયમોનું પાલન કરવાનું રહેશે.

- (૧) દરેક શિબિરાર્થીએ મૌન પાળવાનું રહેશે. નિશ્ચિત કરેલ સમય દરમિયાન અધિકૃત માર્ગદર્શક પાસે ‘આત્મૈષણા’ સંબંધી જાગેલા પ્રશ્નોના ઉત્તર પામવા માટે જ મૌન છોડી શકાશે.
- (૨) જાતે વીજળીના ઉપયોગનો ત્યાગ કરવાનો રહેશે. કોઈ પણ ઈલેક્ટ્રીક સાધનો, સેલ કે સોલાર થી ચાલતા સાધનો લઈને શિબિરમાં નહીં આવી શકાય.
- (૩) શિબિર માત્ર ભાઈઓ માટે જ છે. કોઈ પણ શિબિરાર્થી, બહેનોને મળી શકશે નહીં. બહેનોના ફોટો પણ રાખી શકશે નહીં.
- (૪) શિબિરાર્થી દશ દિવસ દરમિયાન ક્યાંય બહાર જઈ શકશે નહીં. તેમને તેમના ઘરની કે બહારની કોઈ પણ વ્યક્તિ મળી શકશે નહીં. ખાસ કારણથી પણ નહીં.
- (૫) દશ દિવસ એકસણું - એક વાર બેસીને ભોજન કરવું - એ ફરજિયાત છે. તે સિવાય અતનો દાણો કે શરબત સુદ્ધા લઈ શકશો નહીં. ફક્ત સૂર્યાસ્ત સુધી ઉકાળેલું પાણી લઈ શકાશે.
- (૬) એકસાણામાં એકદમ પેટ ભરીને જમવું નિષિદ્ધ છે. ઊંઘોદરી કરવી ફરજિયાત છે. એટલે કે ભૂખ કરતાં થોડું ઓછું જમવું - એ જરૂરી છે. એકસાણું પણ સાઢગીપૂર્ગ કરવાનું રહેશે.
- (૭) આત્મૈષણાના માર્ગદર્શનને સંપૂર્ણપણે અનુસરવું જરૂરી છે.



- (૮) શિબિરાર્થી વધુમાં વધુ - પાંચ જોડી કપડા લાવી શકશે અને તે કપડાં જ દશ દિવસમાં ઉપયોગમાં લેવાના રહેશે. કપડાં જાતે નહીં ધોઈ શકાય અને બહાર ધોવા આપી પણ નહીં શકાય.
- (૯) શિબિરાર્થી પૂજાના શુદ્ધ વખ્તો, સામાયિક માટે બીજા શુદ્ધ વખ્તો, સ્નાન-સામગ્રી, ટુવાલ, વધુમાં પાંચ જોડી વખ્તો, શાલ, ચહ્છાઈ, ચાદર, નેપકીન, રૂમાલ, રોજિંદી દવા, જરૂરી શિયાળું વખ્તો, મચ્છરદાની, જલપાત્ર આટલી જ સામગ્રી લાવી શકશે. તે સિવાયની સાધન સામગ્રી લાવી નહીં શકે.
- (૧૦) દાઢી વગેરે દેહશુશ્નૂષા નહીં કરી શકાય.



## ૪ અરાંમૈષાજ્ઞા - સ્વાતંબર

આત્મૈષાજ્ઞા શિબિરનો કોઈ ચાર્જ ફી નથી કે આત્મૈષાજ્ઞા શિબિરને કોઈ દાન પણ જોઈતું નથી. ‘આત્મૈષાજ્ઞા’નું સંપૂર્ણ ધ્યાન ‘આત્મૈષાજ્ઞા’ માં જ કેન્દ્રિત થાય, તે માટે સ્વાવલંબનનો સિદ્ધાંત અપનાવવા માટે દરેક શિબિરાર્થીને અનુરોધ કરવામાં આવે છે.

- (૧) પલંગ, ગાંદલા, સેપરેટ રૂમ, પરિચારક વગેરે કોઈ અપેક્ષા રાખ્યા વિના, જનરલ હોલમાં સાંગીપૂર્વક રહેવાનું રહેશે. અને પોતે લાવેલી સામગ્રી દ્વારા પોતાની જરૂરિયાતો પૂરી કરવાની રહેશે.
- (૨) ‘આત્મૈષાજ્ઞા’ શિબિર ‘આત્મૈષાજ્ઞા’ પર જ સંપૂર્ણ કોન્સન્ટ્રેટ કરવા માંગે છે. તથા વ્યાપકરૂપે જનતાને લાભાન્વિત કરવા માંગે છે. તેથી દરેક શિબિરાર્થી સ્નાન વગેરે માટે પોતાના નિવાસસ્થાને જઈ આવે તથા પોતાના નિવાસસ્થાને કે નજીકની ભોજનશાળામાં પોતાની રીતે એકાસણું (એક વારનું ભોજન) કરી આવે, એવો અનુરોધ કરવામાં આવે છે. ભોજન માટે કોઈ સામુદ્દરિક વ્યવસ્થા નહીં કરવામાં આવે. ભોજનમાં મસાલા, ધી, તેલ - નો વધુ ઉપયોગ નહીં કરાય. ભોજનમાં રોટલી, દાળ, ભાત, શાક, દૂધ અને ગોળ - આ છ જ વસ્તુનો ઉપયોગ કરી શકાશે. અન્ય કોઈ પણ વસ્તુ વર્જિત છે. દાળ-શાકમાં કે બીજી કોઈ રીતે કંદમૂળ (જમીનકંદ) નો વપરાશ વર્જિત છે.
- (૩) ઉપરોક્ત વ્યવસ્થા સચ્યવાય તે માટે આત્મૈષાજ્ઞામાં લોકલ શિબિરાર્થીઓ લેવામાં આવશે. તીર્થ જેવા સંકુલમાં શિબિર ચોજાય, ત્યારે ટિક્કિનની જરૂર નહીં રહે, પણ શિબિરાર્થીઓએ પોતે જ દશ દિવસના રહેવા-જમવાનો ખર્ચ તીર્થ પેઢીમાં આપી



દેવાનો રહેશે. ‘આત્મૈષુણા’ શિબિર કોઈ પણ આર્થિક આદાન-પ્રદાનનું માધ્યમ નહીં બને.

‘આત્મૈષુણા’ શિબિર એ વિરાટ જનતાની સમસ્ત સમસ્યાઓનું સમાધાન છે. એ પોતે આર્થિક કે વહીવટી સમસ્યાઓમાં ન અટવાય તે માટે ઉપરોક્ત વ્યવસ્થા ઉપયોગી બનશે. માટે તેમાં સહયોગ આપવા વિનંતિ. આ પદ્ધતિથી માર્ગદર્શકની અનુકૂળતાનુસાર ત૩૬૦ દિવસમાં તુદ શિબિર કરવી પણ સાવ જ સરળ બની જશે. હજારો-લાખો લોકો લાભાન્વિત થશે.



## \* આર્તમૈષાદ્ર - SCHEDULE \*

4 A.M. ....	જાગરણ
4.30 A.M. To 6.30 A.M. ....	સામાયિકમય ધ્યાનયોગ
6.30 A.M. To 6.45 A.M. ....	વિશ્રામ
6.45 A.M. To 7.45 A.M. ....	પ્રવચન
7.45 A.M. To 9.00 A.M. ....	સામાયિકમય જ્ઞાનયોગ
9.00 A.M. To 9.30 A.M. ....	(એકાસણાના પર્યક્ખાણમાં પોરસી .....પર્યક્ખાણ પછી) જલપાન, સ્નાન
9.30 A.M. To 11.00 A.M. ....	પૂજામય ધ્યાનયોગ
11.00 A.M. To 11.15 A.M. ..	વિશ્રામ
11.15 A.M. To 12.15 P.M....	એકાસણું (ભોજન)
12.15 P.M. To 1.15 P.M. ....	વિશ્રામ, જલપાન
1.15 P.M. To 2.15 P.M. ....	સામાયિકમય જ્ઞાનયોગ
2.15 P.M. To 4.00 P.M. ....	પર્સનલ ગાઈડન્સ, જલપાન
4.00 P.M. To 6.00 P.M. ....	ધ્યાનયોગ
6.00 P.M. To 7.00 P.M. ....	(સૂર્યસ્ત પહેલા) જલપાન, વિશ્રામ/જ્ઞાનયોગ
7.00 P.M. To 8.00 P.M. ....	સામૂહિક પ્રશ્નોત્તરી
8.00 P.M. To 9.00 P.M. ....	ધ્યાનયોગ
9.00 P.M. ....	વિશ્રામ



## ✽ અરાટમૈધાર - Base ✽

### સાર્થ ઈર્યાપથિકી પ્રતિક્રમણ

વિશ્વના સર્વ જીવો પ્રત્યે ક્ષમાપના કર્યા વિના  
 કોઈ પણ સાધના સફળ થઈ શકતી નથી.  
 તે માટે ભગવાન શ્રી મહાવીરસ્વામીજીએ  
 દરેક સાધનાની પહેલા  
 ઈર્યાપથિકી પ્રતિક્રમણ કરવાનું કહ્યું છે.  
 સાર્થ-નો અર્થ છે અર્થસહિત.  
 મૂળ અર્ધમાગધી ભાષાનું આ વિધાન  
 તેના ગુજરાતી/હિન્દી ભાષાના અર્થને સમજવવા પૂર્વક  
 કરવવામાં આવશે  
 અને પછી આત્મૈધારાની સાધના શરૂ થશે.

ઈર્યાપથિકી પ્રતિક્રમણના વિધાન બાદ  
 દરેક સાધકે પોતાને અપ્રિય વ્યક્તિ-શત્રુ વગેરેને  
 મનમાં યાદ કરીને તેમની માઝી માંગવાની રહેશે  
 અને તેમના પ્રત્યેની કડવાશ કાઢી નાંખવાની રહેશે.  
 અને તેમના સહિત વિશ્વના સર્વ જીવો પ્રત્યે  
 મંગલ ભાવના ભાવવાની રહેશે.

તે આ રીતે -

શિવમસ્તુ સર્વજગતઃ, પરહિતનિરતા ભવન્તુ ભૂતગણઃ ।  
 દોષાઃ પ્રયાન્તુ નાશં, સર્વત્ર સુખી ભવતુ લોકઃ ॥  
 આખા જગતનું કલ્યાણ થાઓ.  
 બધાં જીવો બીજાનું હિત કરવામાં તત્પર થાઓ.  
 દોષો નાશ પામો, બધે બધાં સુખી થાઓ.



## ૪ અર્થમૈષાઉર - આધાર સૂત્ર રહસ્ય

શ્રી ધ્યાનશતક શાસ્ત્ર કહે છે -

કિં બહુણા ? સવ્વં ચિય જીવાઇપયત્થવિત્થરોવેયં ।

સવ્વનયસમૂહમયં ઝાઇજા સમયસબ્ભાવં ॥

વધુ તો કેટલું કહીએ ?

જીવ વગેરે પદાર્થોના વિસ્તારથી યુક્ત

સર્વ નયોના સમૂહમય

સર્વ સિદ્ધાન્તતત્ત્વનું ધ્યાન કરવું જોઈએ.

આ વચન સ્પષ્ટ જાણાવે છે કે શાસ્ત્રોનું કોઈ પણ તત્ત્વ ધ્યાનનું આલંબન બની શકે છે. પ્રસ્તુતમાં-આત્મૈષાણી સાધના માટે સર્વોત્કૃષ્ટ કહી શકાય તેવા પરમ પાવન આગમ વચનોનો આધારસૂત્ર તરીકે સ્વીકાર કરેલ છે.

આ અમૃતમય વચનોની ધારણાતીત અસર

દરેક સાધકને અવશ્ય અનુભવાશે.

બહુ સરળ અને સમર્પિત સાધકો આ સાધનાનો મહત્તમ લાભ પામી શકશે. તેવા સાધકને અવશ્ય તેના ચમત્કારિક પરિણામો મળશે. માટે દરેક સાધકે સરળતા અને સમર્પણ વધારવા માટે પ્રયાસ કરવો.



## ૪ દર્શાવ - WHY ?

મોક્ષ: કર્મક્ષયાદેવ, સ ચાત્પજ્ઞાનતો મત: ।  
 ધ્યાનસાધ્યં મતં તત્ત્વ, તદ્દ ધ્યાનં હિતમાત્મનઃ ॥  
 મોક્ષ કર્મક્ષયથી જ થાય છે  
 કર્મક્ષય થાય છે આત્મજ્ઞાનથી  
 આત્મજ્ઞાન થાય છે ધ્યાનથી  
 માટે ધ્યાન આત્માનું હિત કરે છે.

- કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય  
 યોગશાસ્ત્ર

અધ્યાત્મસાર ગ્રંથ સ્પષ્ટ કહે છે -

કોધ વગેરે દોષોની દવા છે ધ્યાન.  
 કષોની વર્ચ્યે પણ સુખી રહેવાનો પરવાનો છે ધ્યાન.  
 ભીતરનો પ્રકાશ પામવાનો પંથ છે ધ્યાન.  
 તમારો ખરો મિત્ર છે ધ્યાન.  
 એક શીતળ ઘર છે ધ્યાન.  
 ખરું અમૃત છે ધ્યાન.  
 પરમ મધુર રસ છે ધ્યાન.  
 તમારી બધી જ સમસ્યાઓનું સમાધાન છે ધ્યાન.



ધ્યાનની ભૂમિકા માટે ‘આત્મૈષણા’ દ્વારા હવે બાકી રહેલા બે સ્ટેપ્સનો નિર્દેશ કરવામાં આવે છે. તે છે ગ્રાણાયામ અને ધારણા.

સર્વ પ્રથમ અંદું કારના નાદ દ્વારા એકદમ હળવા ગ્રાણાયામનો પ્રયોગ કરવાનો રહેશે. (અંદું) કારનો નાદ બે પદ્ધતિથી કરવાનો રહેશે.

(૧) ઓ - નો નાદ ૭૦ % જેટલો મું નો નાદ ૩૦ % જેટલો.

(૨) ઓ - નો નાદ ૩૦ % જેટલો, મું નો નાદ ૭૦ % જેટલો.

પહેલી પદ્ધતિથી ત્રાણ વાર નાદ કરી, પછી બીજી પદ્ધતિથી ત્રાણ વાર નાદ કરવાનો રહેશે.

### નાદ-સૂચના

(૧) દરેક વખતે નાદ અંદર એક શાસ્ત્રે ધીમે ધીમે કરાય.

(૨) દરેક નાદ નાભિમાંથી ઊઠવો જોઈએ.

(૩) કૃત્રિમ રીતે મોટો અવાજ કાઢવાનો ગ્રાણાસ ન કરવો.

(૪) બે નાદ વચ્ચે ત્રાણ સેકન્ડનું અંતર રાખવું.

### ત્રાણ ગ્રાણાયામ

નાદ પછી ત્રાણ ગ્રાણાયામ કરવાના રહેશે.

(૧) રેચક - ધીમે ધીમે બધો શાસ બહાર કાઢી દેવો. તે સમયે વિચારવું કે આપણો બધો જ થાક, હતાશા, ગુસ્સો, અહં, છણ, લોભ, વાસના બધું જ બહાર નીકળી રહ્યું છે.

(૨) પૂરક - પછી ધીમે ધીમે શાસ લેતા જવો. તે સમયે વિચારવું કે આપણામાં સત્ય, ક્ષમા, સહનશીલતા, સંતોષ, સરળતા, સાદાચાર, કરુણા, વિનય, નિઃસ્પૃહતા વગેરે ગુણો પ્રવેશી રહ્યા છે.

(૩) કુંભક - લીધેલા શાસને અંદર રોકી રાખવો. એ સમયે વિચારવું કે આપણા આત્મામાં ગુણો વ્યાપી રહ્યા છે.

(કુંભક અને રેચક વચ્ચે ? સેકન્ડનો સમય રાખવો.)



આ ત્રણ પ્રકારનો મ્રાણાયામ ત્રણ વાર કરવો. પછી પ્રેક્ટીકલ અંતર્યાત્રા કરવી, જેનાથી મન ઉંડાણ સાથે બંધાય.

### પ્રેક્ટીકલ અંતર્યાત્રા

ટૃપ્તાર શરીર, ધ્યાનમુદ્રા, આંખો બંધ, એકાગ્ર મન...

તમારા મનના દશ લેવલની કલ્પના કરો. અત્યારે તમે સૌથી બહુરના - સૌથી ઉપરના લેવલમાં છો. હવે તમે પ્રયાસ કરો છો અંદર ઉત્તરવાનો. હું ૧૦ થી ૧ સુધી બોલતો જઈશ અને તમે વધુ ને વધુ અંદર ઉત્તરતા જશો.

દશ

નવ

આઠ

હજુ અંદર... ઉંડે... હજુ ઉંડે.

પરમ આનંદ અને પરમ શાંતિની દુનિયામાં  
આપણે પ્રવેશ કરી રહ્યા છીએ.

સાત

દ્વા

હજુ અંદર

પાંચ

હજુ અંદર

ચાર

હજુ અંદર

અહીં કેટલી શાંતિ છે ! કેટલી હળવાશ લાગે છે.

ત્રણ

બે

એક



તમે તમારા મનના છે'ક તળિયે પહોંચી ગયા છો.  
જ્યાં છે પરમ શાંતિ  
પરમ આનંદ  
પરમ સુખ.

દરેક ધ્યાન સેશન પહેલા આ ત્રાણ ભૂમિકા કરવી -  
ॐ કાર નાંદ, માણાયામ અને અંતર્યાત્રા.



## ✽ અર્થમેષાહર્ર - પ્રથમ ત્રણ હિતસનું ધ્યાન ✽

### આધારસૂત્ર

જે અણન્નદંસી સે અણન્નારામે ।

જે અણન્નારામે સે અણન્નદંસી ॥

જે અનન્યદર્શી છે, તે અનન્યમાં રમે છે.

જે અનન્યમાં રમે છે, તે અનન્યદર્શી છે.

- પરમ પાવન શ્રી આચારાંગસૂત્ર

### પ્રેક્ટીકલ ધ્યાન

તમે કોણ છો ? 'હું' આ સંવેદનથી જે જાણાય છે  
તે તમે છો.

આત્મા.

આત્માને શોધવાનો પ્રયાસ કરો.  
ચામડી, સ્નાયુ, લોહી, માંસ, હાડકાં, ફેફસા, નસો  
આ બધાંથી જુદો છે આત્મા.  
અનુભવવાનો પ્રયાસ કરો.

ચામડીનું આવરણ તમારાથી જુદુ થઈ રહ્યું છે.  
તમારી સંપૂર્ણ ચામડી તમારાથી જુદી થઈ રહી છે.  
તમે ટોટલી ચામડી રહિત બની ચુક્યા છો.  
સ્નાયુઓ અને નસો પણ તમારાથી જુદા થઈ રહ્યા છે.  
આંતરડાંઓ, ફેફસા, લોહી, માંસ  
તમારાથી જુદા થઈ રહ્યા છે.  
હોજરી, હંદ્ય, આમારાય, પિતારાય, મૂત્રારાય, કિડની  
બધું જ તમારાથી જુદું થઈ રહ્યું છે.



તમારા બધાં જ હાડકા તમારાથી જુદા થઈ રહ્યા છે.  
હવે બીજું કશું જ નથી.

હવે ફક્ત તમે છો.

ફક્ત તમે.

આત્મા.

એના દર્શનમાં તુંબી જાઓ.  
અનુભવવાનો પ્રયાસ કરો.  
તમે તમને જોઈ રહ્યા છો.  
તમે છો શુદ્ધ સ્વરૂપ.  
સ્ફટિક જેવા નિર્મળ.  
પરમ જ્યોતિ સ્વરૂપ  
પરમ સુખના સાગર  
પરમ આનંદના આસામી.

અનન્ય.

બેજોડ.

અદ્વિતીય.

અતુલ્ય.

તમે તમારાથી પ્રભાવિત થઈ રહ્યા છો.  
તમે તમારા પર આઝરીન થઈ રહ્યા છો.  
તમે જોઈ રહ્યા છો કે તમે વિશ્વશ્રેષ્ઠ છો.  
તમે અનુભવી રહ્યા છો કે વિશ્વનો સર્વोત્કૃષ્ટ વૈભવ  
વર્લની ટોપ કલાસની વેલ્થ  
તમે જ છો.



બસ,

હવે તમે ફક્ત તમને જ જોયા કરો છો.

ને ફક્ત તમારામાં જ રમણ કર્યા કરો છો.

જસ્ટ લુક યોર સેલ્ફ

પલે ઈન સેલ્ફ

હવે તમે સતત તમને જ જોયા કરશો.

તમારામાં જ તુબકી લગાવ્યા કરશો.

તમારો આનંદ માઝા કરશો.

‘આત્મિષણા’ શિબિરના પહેલા નાણ દિવસ દરેક ધ્યાન સેશનમાં પૂર્વ ભૂમિકા પછી આટલું ધ્યાન માર્ગદર્શક બોલીને કરાવે. પછી દરેક સાધક સ્વયં સ્વને જોવા અને સ્વમાં રમણ કરવાની ધારામાં જતો રહે. અને હોલમાં મૌન છવાયેલું રહે.



❀ અર્તમૈષાજ્ઞા - ચોથા દિવસનું ધ્યાન ❀

આધારસૂત્ર

જે અજ્ઞાતથી જાણિ સે બહિયા જાણિ  
જે ભીતરી વસ્તુને જાણો છે,  
એ બાધ્ય વસ્તુને જાણો છે.

- પરમ પાવન શ્રી આચારાંગ સૂત્ર

પ્રેક્ટીકલ ધ્યાન

ત્રણ દિવસના ધ્યાનના અનુભવે  
તમને એ તથ્ય આપ્યું  
કે આત્માની તુલનામાં આખી દુનિયા શૂન્ય છે.  
વ્યર્થ છે.

આત્મા એ કોહિનૂર હીરો છે.  
અનુભવવાનો પ્રયાસ કરો.  
તમારો આત્મા ઝગારા મારતો હીરો છે.

અદ્ભૂત હીરો.  
તેજ વેરતો હીરો.  
લાઈટિંગ ડાયમન્ડ.

ફીલ યોરસેલ્ફ એઝ એ સચ ડાયમન્ડ.  
ને એની સામે દુનિયાની બધી જ વસ્તુને  
'ધૂળ' તરીકે જોવાનો પ્રયાસ કરો.  
મની એ ધૂળ છે.  
બંગલો એ ધૂળ છે.  
ગાડી એ ધૂળ છે.



ગેજેટ્સ એ ધૂળ છે.  
 એટ્રોક્ટીવ લાગતા બોડીજ પણ ધૂળ છે.  
 પ્રેસ્ટીજ એ પણ ધૂળ છે.  
 સારા કપડાં, ઘરેણાં, મનોરંજનના સાધનો  
     બધું જ ધૂળ છે.  
 જ્યાં સુધી આત્માની વેલ્યુ સમજાઈ ન હતી  
     ત્યાં સુધી આ બધું ગમતું હતું.  
     આત્માની વેલ્યુ સમજાઈ  
         એટલે આ બધું જ  
             ફોગટ લાગે છે.  
         બેકાર લાગે છે.  
     અનુભવ કરવાનો પ્રયાસ કરો.  
     સમગ્ર વિશ્વમાં કેન્દ્રસ્થાને  
     અદ્ભૂત હીરા જેવો તમારો આત્મા છે.  
         અને  
     તેના સિવાયની આખી દુનિયા  
     ધૂળ સિવાય બીજું કાંઈ જ નથી.  
     તમે હીરા છો, બીજું બધું જ ધૂળ છે.

માર્ગદર્શક આટલું કહીને મૌન થઈ જશે. સાધકો સતત પોતાના આત્માનું હીરા તરીકે દર્શન કરશે અને દુન્યવી બધાં જ પદાર્થોને ધૂળ તરીકે જોતા રહેશે. ચોથા દિવસના દરેક ધ્યાન સેશનમાં આ ધ્યાન કરવાનું છે.



✿ અર્તમૈષાણ - પાંચમાં દિવસનું ધ્યાન ✿

આધારસૂત્ર

અગં ચ મૂલં ચ વિગિંચ ધીરે ।

હે ધીર ! તું અગ્ર અને મૂળ  
આ બંનેનો ત્યાગ કર.

‘મૂળ’ છે મોહૃ ને ‘અગ્ર’ છે  
મોહૃથી ઊભી થયેલી બધી જ જંજાળ.

- પરમ પાવન શ્રી આચારાંગસૂત્ર

પ્રેક્ટીકલ ધ્યાન

સોનામાંથી સોના સિવાયનું

બધું જ નીકળી જાય  
એટલે સોનું શુદ્ધ બને છે.

આત્મામાં આત્મા સિવાયનું આવ્યું ક્યાંથી ?  
એ શું હતું જેણે આત્માને અશુદ્ધ બનાવ્યો ?  
એ છે મોહૃ.

મોહૃ એ આત્માનો મૂળભૂત કચરો છે.  
જે કોઇ, અહુંકાર, કામ, લોભ, કપટ, મત્સર  
વગેરે અનેક કચરાઓને લઈ આવે છે.

કરવા જેવું કામ આ જ છે.  
મોહૃને ઉખેડી નાંખો.

મોહૃ દ્વારા આવેલી બધી જ જંજાળોને ઉખેડી નાંખો.

મૂળ જશો  
એટલે ઝડ ઝડ જશો જ  
ને એ બે ગયા  
એટલે બાકી રહેશે તમારો આત્મા.



શુદ્ધ આત્મા.

અનુભવવાનો પ્રયાસ કરો.

તમે તમારા આત્મામાંથી મોહુને ઉખડી રહ્યા છો.

બધા જ પ્રકારના મોહુને

અનુભવવાનો પ્રયાસ કરો.

તમારો બધો જ મોહુ ઉખડી ઉખડીને

તમારામાંથી દૂર થઈ રહ્યો છે.

એની સાથે જ કોધ, અહું, છળ, લોભ,

કામ, મત્સર આ બધાં જ દોષો પણ

આત્મામાંથી છૂટ્ટા પડી પડીને

દૂર થઈ રહ્યા છે.

અનુભવવાનો પ્રયાસ કરો.

હવે તમે સંપૂર્ણપણે મોહુમુક્ત બની ગયા છો.

સંપૂર્ણપણે કોધમુક્ત, અહુમુક્ત, છળમુક્ત, લોભમુક્ત,

કામમુક્ત, મત્સરમુક્ત. સંપૂર્ણપણે દોષમુક્ત.

આ દશાને તમે અનુભવી રહ્યા છો.

તમે માણી રહ્યા છો તમારા શુદ્ધ સ્વરૂપને,

તમારા ઓરિજિનલ સ્વરૂપને

જેમાં પરમ આનંદનું સાખ્રાજ્ય એકછત્રી રીતે છવાયેલું છે.

આટલું કહીને માર્ગદર્શક મૌન થઈ જશે. સાધકો સતત એવું ધ્યાન કરશે કે મોહુ અને અન્ય દોષો આત્મામાંથી ઉખેડાઈ રહ્યા છે. અને આત્માને વધુને વધુ શુદ્ધ સ્વરૂપનો અનુભવ થઈ રહ્યો છે.



## ❀ અરાતમૈષાજ્ઞા - છટઠા દિવસનું ધ્યાન ❀

**આધારસૂત્ર**

પલિંઘિદિયા ણ ણિકમ્મદંસી ।

તું રાગ અને દ્રેષ્ણે છેદજે

અને તારા કર્મભુક્ત સ્વરૂપનું દર્શન કરજે.

- પરમ પાવન શ્રી આચારાંગસૂત્ર

**પ્રેક્ટીકલ ધ્યાન**

રાગ અને દ્રેષ્ણ.

ગમો અને આણગમો.

આમાં દુનિયાના બધાં જ દોષો સમાઈ જાય છે.

આત્માના ખરા બંધન આ જ છે - રાગ અને દ્રેષ્ણ.

મુક્તિનો અર્થ આ જ છે -

રાગ-દ્રેષ્ણથી મુક્ત થવું.

રાગ-દ્રેષ્ણથી જ કર્મ બંધાય છે.

કર્મોથી જ આત્મા જકડાય છે.

અને એક વિષયકમાં ફસાઈ જાય છે.

જે રાગ-દ્રેષ્ણના બંધનોને કાપી નાંખે છે

તે પોતાને કર્મરહિત-શુદ્ધ સ્વરૂપે જુઓ છે.

અનુભવવાનો પ્રયાસ કરો.

તમે તમારા રાગ-દ્રેષ્ણને કાપી રહ્યા છો.

હવે તમને કશું ગમતું પણ નથી

અને આણગમતું પણ નથી.

દુનિયાની બધી જ વ્યક્તિ તમારા માટે સમાન છે.

દુનિયાની બધી જ વસ્તુ તમારા માટે સમાન છે.



તમારું સંપૂર્ણ અસ્તિત્વ સમતામય બની ચુક્કું છે.

તમારા કર્મ-તમારા આત્માનો કચરો

ખૂબ જ ઝડપથી દૂર થઈ રહ્યો છે.

તમે વધુ ને વધુ શુદ્ધ થઈ રહ્યા છો.

તમે તમારામાં ભગવાનને જુઓ છો.

તમે ભગવાન બની રહ્યા છો.

જીવન્મુક્તિનો આનંદ તમારામાં ઊભરાઈ રહ્યો છે.

આટલું કહીને માર્ગદર્શક મૌન થઈ જશે.

સાધકો સતત એવું ધ્યાન કરશો

કે તેમના રાગ-દ્રેષ્ણને તેઓ કાપી રહ્યા છે.

કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે ઘટનાના ગમા કે

આણગમાથી તેઓ મુક્ત થઈ રહ્યા છે.

સમભાવથી વ્યામ થઈ રહ્યા છે

અને સ્વયં ભગવાન બની

પરમાનંદનો અનુભવ કરી રહ્યા છે.



## ✿ અર્તમૈષાણ - સાતમા દિવસનું ધ્યાન ✿

### આધારસૂત્ર

કા અર્દી કે આણંદે ઇત્�ં પિ અગાહે ચરે ।  
શું દુઃખ કે શું સુખ - એમાં પાણ અજાણ બની રહે.

- પરમ પાવન શ્રી આચારાંગસૂત્ર

### પ્રેક્ટીકલ ધ્યાન

બાધ્ય સુખ-દુઃખો  
જે છે એ છે.

હકીકતમાં એનાથી તમને કોઈ જ ફરક પડતો નથી.

છા,

તમે એમને માથે ચડાવો, તો એ તમારા અવરોધો બની જાય છે.  
આત્માને શોધ્યા પછી, જોયા પછી, જાણ્યા ને માણ્યા પછી  
તમારે આ જ કામ કરવા જેવું છે.

બાધ્ય સુખ-દુઃખના અનુભવથી શૂન્ય બની જવું.

યા બાધ્યનો અનુભવ થશો, યા આંતરનો અનુભવ થશો.

બાધ્ય ચીંથરાથી ય જાય એવું છે.

આંતર ચિંતામણિથી ય અમૂલ્ય છે.

કોના માટે કોને ગુમાવવું એ આપણે નક્કી કરવાનું છે.

આત્માના અનુભવની માસ્ટર કી આ જ છે.

આત્મા સિવાયના બીજા બધા જ અનુભવોથી શૂન્ય બની જાઓ.

અનુભવ કરવાનો ગ્રયાસ કરો.

બાધ્ય કોઈ પણ સુખ-દુઃખનો તમને કોઈ જ અનુભવ નથી થઈ રહ્યો.

દંડી, ગરમી, ભૂખ, તરસ, રોગ, આકોશ, નિંદા, પ્રશંસા, અક્સમાત.

નાઉ યુ આર ટોટલી એક્સપિરિયન્સ - ફી.



તમને આ બધાની કોઈ જ અસર થતી નથી.

જાણો આ બધું છે જ નહીં.

જાણો આ બધું તમારા સંપર્કમાં આવ્યું જ નથી.

જાણો આ બધા માટે તમે પૂતળા છો.

અનુભવ કરવાનો પ્રયાસ કરો.

સંસારની એક પદ્ધી એક તકલીફ તમારા પર આવી રહી છે.

શારીરિક-માનસિક દુઃખો એક પદ્ધી એક આવી રહ્યા છે.

ને તમને કશું જ થતું નથી.

તમને ખબર સુદ્ધા પડતી નથી.

અનુભવ કરવાનો પ્રયાસ કરો.

સંસારના એક પદ્ધી એક સુખ તમારા સંપર્કમાં આવે છે.

ઈન્દ્રિયોના શુભ વિષયો, પ્રશંસા, સત્કાર...

ને તમને કોઈ જ ફરક પડતો નથી.

તમને કશું જ અડતું નથી.

તમે પૂર્ણપણો નિર્લેપ છો.

તમે અનુભવી રહ્યા છો તમને.

માત્ર પોતાને.

આટલું કહીને માર્ગદર્શક મૌન થઈ જશે. સાધકો સતત એવું ધ્યાન કરશે કે તેમના પર બાધ્ય સુખ-દુઃખની કોઈ જ અસર થતી નથી. તેઓને તેની જાણ સુદ્ધા થતી નથી. સાતમા દિવસે દરેક ધ્યાન સેશનમાં આ ધ્યાન કરવાનું છે.



## ✿ અાત્મૈષાળ્ય - આઠમા દિવસનું ધ્યાન ✿

### આધારસૂત્ર

ઉવેહિ ણ બહિયા ય લોગં ।

સમગ્ર બાધ્ય વિશ્વને તું ઉપેક્ષાદૃષ્ટિથી જો.

- પરમ પાવન શ્રી આચારાંગ સૂત્ર

### પ્રેક્ટીકલ ધ્યાન

સ્વ-પરિચયનું મૂલ્ય એ છે

કે તમે 'પર'થી પૂર્ણપણે અજાણ બની જાઓ.

'પર' તમારા માટે અજાણું બને.

અપરિચિત બને.

અણગું બને.

એની તમારામાં કશી નોંધ જ ન લેવાય.

અનુભવ કરવાનો પ્રયાસ કરો

સ્વજન કે પરજન-બધાં જ તમારા માટે સરખા બની ચુક્યા છે.

જાણ્યા કે અજાણ્યા એ બધાંમાં કોઈ ફરક જ નથી રહ્યો.

તમે રસ્તા પરથી જઈ રહ્યા છો.

સામેથી કતારબંધ લોકો આવી રહ્યા છે.

એમાં ઘણા બધાં લોકો અજાણ્યા છે.

કોઈક કોઈક લોકો જાણીતા છે.

કોઈ મિત્ર છે, કોઈ સંબંધી છે, કોઈ સગાં છે.

કોઈ ઓળખીતા છે. કોઈ તમારા ઘરના જ સભ્યો છે.

તમને બધાના ચૂહેરા દેખાય છે.

પણ તેની કોઈ છાપ તમારા મન પર પડતી નથી.



ન સારી, ન નરસી.

જે રીતે તમે અજાણ્યા લોકોને જુઓ છો  
બરાબર એ જ રીતે તમે પરિચિતોને જુઓ છો.  
તમારા ચહેરાની રેખા પાણ બદલાતી નથી.  
તમારી આંખોમાં એ જ ઉદાસીનતા છે,  
એ જ ઉપેક્ષાભાવ છે,  
જે અજાણ્યા લોકો પ્રત્યે છે.

તમે ચીજ-વસ્તુઓને જોઈ રહ્યા છો.

અમુક વસ્તુ પહેલા ગમતી હતી, અમુક વસ્તુ આણગમતી હતી,  
અત્યારે બધું જ સરખું થઈ ગયું છે.  
તમે એને એ રીતે જુઓ છો  
જાણે તમે એમને જોતા નથી.  
આનું નામ ઉપેક્ષાદિષ્ટિ.

જેમાં જોવામાં જોવા સિવાય બીજું કશું જ નથી.

છે ફક્ત ‘જોવું’.

બીજું કશું જ નહીં.

પ્રયાસ કરો.

તમે દુનિયાને આ જ દિલ્લિથી જોઈ રહ્યા છો.

આટલું કહીને માર્ગદર્શક મૌન થઈ જશે. સાધકો સતત એવું  
ધ્યાન કરશે કે તેઓ પરિચિત-અપરિચિત, ગમતી-આણગમતી દરેક  
વસ્તુ, વ્યક્તિ કે સ્થાનને ઉપેક્ષા દિલ્લિથી જોઈ રહ્યા છે.



✿ અાત્મૈષાણ - નવમા અને દશમા દિવસનું ધ્યાન ✿

આધારસૂત્ર

સે સયં પવેસિયા ઝાડ ।

પ્રભુ વીર પોતામાં પ્રવેશીને ધ્યાન કરે છે.

- પરમ પાવન શ્રી આચારાંગસૂત્ર

પ્રેક્ટીકલ ધ્યાન

પ્રભુ વીરના સાધનાકાળમાં સતત ચિત્ર-વિચિત્ર નિમિત્તો

આવતા રહ્યા હતા.

ભયાનક વેદના આપતા કષ્ટો, આકોશો, પ્રહુરો

મોત જ લાવી દે એવા હુમલાઓ,

વગેરે કર્કશ વિઘ્નો પણ આવ્યા.

ને રૂપરમાણીઓ, અભ્યરાઓ, ગીતો, નૃત્યો,

મદહુરોશ કરી દે એવા વાતાવરણનું સર્જન

વગેરે સુંવાળા વિઘ્નો પણ આવ્યા.

એ સમગ્ર પરિસ્થિતિઓમાં પ્રભુએ શું કર્યુ ?

બળતો ઉનાળો ને હાડ થીજાવી દે એવો શિયાળો

એમાં પ્રભુએ શું કર્યુ ?

ભયાનક ગાળો અને સુંદર સ્તુતિઓ

એમાં પ્રભુએ શું કર્યુ ?

પ્રભુએ પોતે પોતામાં પ્રવેશ કર્યો,

પ્રભુએ પોતે જ પોતાનામાં તુબકી લગાવી,

પ્રભુ પોતાની ભીતરમાં ઉતરી ગયા

અને પ્રભુએ ધ્યાનસાધના શરૂ કરી દીધી.



तथा समाधौ परमे त्वयात्मा विनिवेशितः ।  
सुखी दुःख्यस्मि ना स्मीति यथा न प्रतिपन्नवान् ॥

- वीतराग स्तोत्र

प्रभु परम समाधिमां ऐ रीते उंडा उतरी गया  
के बहुरना सुभ-दुःखनुं कोઈ ध्यान ज न रहुं.  
बहुर कशुं य न होय ने छतां छो तमे अंदर न उतरो  
तो ध्यान शक्य नथी.  
बहुर होनारतो होय, जंजावातो होय, पाण छो तमे अंदर उतरो  
तो ध्यान शक्य छे.

अनुभववानो प्रयास करो.

आस-पासमां जे कांઈ पाण थઈ रहुं छे,

तेनी कोई पाण परवा कर्या विना

तमे तमारामां ग्रेशो छो.

तमे तमारामां दूषकी भारो छो.

तमे तमारामां लयलीन बनी जाओ छो.

अनुभववानो प्रयास करो.

तमे तमारी अंदर आवी गया छो.

तमे तमारुं कवच छो.

तमे तमारी ऊर्जा छो.

तमे ज तमारी दुनिया छो.

तमारी दुनियामां तमारा सिवाय बीजुं कशुं ज नथी.

तमे तमारो आस्वाद लई रह्या छो.

तमे तमने भाणी रह्या छो.

तमे तमारा-भय बनी गया छो.



પરમ સુખ  
પરમ શાંતિ  
પરમ સમૃદ્ધિ  
પરમ આનંદ  
પરમ સ્વાસ્થ્ય

આત્મધ્યાનનો આ અનુભવ સતત તમારી ભીતર ચાલી રહ્યો છે.

માર્ગદર્શક આટલું બોલીને મૌન થઈ જશે. સાધકો આત્મમગ્રતા અને આત્મધ્યાનનો સતત અનુભવ કરતા રહેશે. પ્રવેશ એક વાર થશે, મગ્રતા અને ધ્યાન સતત થયા કરશે. આત્મૈષણાના નવમા અને દશમાં દિવસે દરેક ધ્યાન સેશનમાં આ જ ધ્યાન કરવાનું રહેશે.



## ❀ અરાત્મેષાણ - પૂજામય ધ્યાનયોગ ❀

કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યકૃત યોગશાસ્ત્રમાં એક ખાસ ધ્યાનનો નિર્દેશ છે - રૂપસ્થ ધ્યાન.

આ ધ્યાનનો એક પ્રકાર છે -

જિનપ્રતિમા સમક્ષ ધ્યાન ધરવું.

આત્મૈષાણ શિબિરમાં પૂજામય ધ્યાનયોગમાં કમશા: દરેક સાધક જિનપૂજા કરશે અને શેષ બધાં જ સાધક રૂપસ્થ ધ્યાન કરશે. બિન-જૈન સાધકોએ જિનપૂજા કરવી ફરજિયાત નથી. તેઓ માત્ર રૂપસ્થ ધ્યાન કરી શકશે.

### ગ્રેક્ટીકલ રૂપસ્થ ધ્યાન

પરમ શાંત રસના સાક્ષાત્ ઝરા સમા છે પરમાત્મા

નથી એમને રાગ,

નથી એમને દ્રેષ,

નથી એમને મોષ.

કેવું સુંદર છે એમનું રૂપ !

કેવી મનોહર છે એમની યોગમુદ્રા !

કેવું અદ્ભુત છે એમનું સ્વરૂપ !

સર્વ દોષથી મુક્ત...

સર્વ ગુણોથી યુક્ત...

અદ્ભુત.

ખરેખર અદ્ભુત.

આ જ છે મારું શુદ્ધ સ્વરૂપ.

આ જ છે મારું લક્ષ્ય.

આ જ છે મારું સ્વર્ણ.



બસ,

હું બરાબર એમના જેવો જ થઈશ.

સર્વ દોષથી મુક્ત.

સર્વ ગુણોથી યુક્ત.

પરમ શાંત રસનો સાક્ષાત્ ઝરો.

હું આવો જ થઈશ.

માર્ગદર્શક આટલું કહીને મૌન થઈ જશે.

અને સાધકો આ જ ધ્યાનની ધારાને સ્વયં આગળ ચલાવશે.



## ✿ અરાત્મેષણુર્ - જ્ઞાનયોગ ✿

ધ્યાનયોગ માટે જ્ઞાનયોગ એટલો જ જરૂરી છે,  
જેટલું ખેતી માટે પાણી જરૂરી છે.  
ભગવાન શ્રી મહાવીરસ્વામી કહે છે -

જય સુદુ અહીયં ભવઙ્સ ।

તથા સુદુ જ્ઞાણ ભવઙ્સ ।

જ્યારે જ્ઞાનાભ્યાસ સારો થયો હોય છે  
ત્યારે ધ્યાન સારું થાય છે.

- પરમ પાવન શ્રી સ્થાનાંગ આગમ સૂત્ર  
આત્મૈષણા શિબિરના સાધકોએ કોઈ પણ પ્રકારની વાંચનસામગ્રી  
શિબિરમાં લાવવાની હોતી નથી. સાધકોની બે ભૂમિકા અનુસાર તેમને વાંચન  
સામગ્રી અપાશે.

ભૂમિકા એક - જ્ઞાનયોગમાં ઓછા-વતા પ્રવેશોલા સાધકો.

ભૂમિકા બે - નૂતન સાધકો.

પહેલી ભૂમિકાના સાધકો માટે વાચનસામગ્રી અપાશે -

યોગીરાજ શ્રી આનંદઘનીય અધ્યાત્મ પદો.

બીજી ભૂમિકાના સાધકો માટે વાચન સામગ્રી અપાશે -

સમરાદિત્ય મહાકથા.

સાધકોએ જ્ઞાનયોગના સમયમાં વ્યક્તિગત રીતે આ સામગ્રીનું  
વાંચન કરવાનું રહેશે. આ સામગ્રી શિબિર બાદ પરત આપવાની  
રહેશે. તેનું વેંચાણ નહીં કરાય, તથા તેનો કોઈ ચાર્જ પણ નહીં  
લેવાય.



## ❀ અર્થમૈષાળી - અનુપ્રેક્ષા ❀

ધ્યાનશાંતક ગ્રંથ કહે છે -

જ્ઞાણોવરમે વિ સુણી, ણિચ્ચમણિચ્ચાઇચિંતણાપરમો ।  
ધ્યાન પદ્ધી પણ મુનિએ હુંમેશા અનિત્યાદિ  
ચિંતન = અનુપ્રેક્ષા કરવી જોઈએ.

અધ્યાત્મસાર ગ્રંથ કહે છે -

અનિત્યત્વાદ્યનુપ્રેક્ષા, ધ્યાનસ્યોપસેડપિ હિ ।

ભાવયેન્નિત્યમભ્રાન્તઃ, પ્રાણ ધ્યાનસ્ય તા: ખલુ ॥

ધ્યાન પુરું થાય પદ્ધી પણ હુંમેશા અભ્રાન્તપણે અનિત્યત્વ વગેરે  
અનુપ્રેક્ષા કરવી જોઈએ. કારણ કે તે અનુપ્રેક્ષાઓ ધ્યાનનો પ્રાણ છે.

સાધકોને જ્ઞાનયોગ માટે જે સામગ્રી આપવામાં આવશે,  
તેમાં સરળ રીતે ઉપરોક્ત અનુપ્રેક્ષાઓ પણ આવી જશે.



## ૫ અર્તમૈષાણ - સમાપન

દશમા દિવસે સાંજે છ વાગે આત્મૈષાણ શિબિર પૂરી થઈ જશે. દરેક સાધક આત્મૈષાણનું અમૂલ્ય ફળ પામીને વિદાય લેશે.

દરેક સાધકને અનુરોધ છે કે પ્રતિદિન કમ સે કમ એક કલાક માટે જ્ઞાનયોગ અને ધ્યાનયોગની સાધના અવશ્ય કરે, જેથી તેમનામાં આ સાધનાના સંસ્કાર જળવાઈ રહે.

દર વર્ષે કમ સે કમ એક વાર આત્મૈષાણની સાધના કરવાથી આખા વર્ષની ઉર્જા અને તાજગી મળી રહેશે.

આત્મૈષાણથી લાભાન્વિત થયેલા દરેક સાધકને અનુરોધ કરવામાં આવે છે કે તે આ લાભને પરમેનન્ટ બનાવે. વધુ ને વધુ ઊંડા ઉતરે, અને આ જીવનના ખરા લક્ષ્યને સર કરે. આત્મૈષાણ શિબિરમાં પાણેલા વિશિષ્ટ નિયમોને રોજિંદા જીવનમાં પણ જેટલા પોસિબલ હોય તેટલા અપનાવે અને સાધનાની આ ધારાને અખંડિત રાખવા દ્વારા પોતાના આત્માનું કલ્યાણ કરે. માર્ગદર્શકોને આથી વધુ કોઈ જ અપેક્ષા નથી.



## ૪ આર્તમૈષાણ - તમને આવું થશો

- \* પહેલા દિવસે તમને સાધના કરવી ઘણી અધરી પડશે. લગભગ બધું જ નીરસ અને કંટાળાજનક લાગશે. કદાચ સાધના છોડીને જતા રહેવાની ઈચ્છા થશે.
- \* બીજા દિવસે તમને થોડું સારું લાગશે.
- \* ત્રીજા દિવસે તમારું મન સાધનામાં ઘણું-ખરું ઠરશે.
- \* ચોથા દિવસથી તમને સાધના ગમશે. ખૂબ જ આનંદ આવવા લાગશે.
- \* પાંચમા દિવસે તમને તમારામાં નોંધપાત્ર પરિવર્તનો જણાશે. ખૂબ ઝડપથી તમારું વ્યક્તિત્વ વિકસી રહ્યું છે, એવો તમને અનુભવ થશે.
- \* છઠ્ઠા દિવસે તમને લાગશે કે તમારા દોષોમાં ધરખમ ઘટાડો થઈ ગયો છે. તમે તમને ગુણવાન તરીકે અનુભવશો.
- \* સાતમા દિવસે તમને લાગશે કે તમારી આખી દણિ જ બદલાઈ ગઈ છે. તમે દુનિયાને નવા જ સ્વરૂપે જોવા લાગશો.
- \* આઠમા દિવસે તમને અંદરથી અસીમ આનંદ ઊભરાતો જણાશે. તમે સહજ પ્રસંગતાનો અનુભવ કરવા લાગશો.
- \* નવમા અને દશમા દિવસે તમે સ્પષ્ટ અનુભવશો કે તમે ટોટલી બદલાઈ ગયા છો. તમને તમારા જીવનનું અમૃત મળી ચુક્યું છે. તમને બધી જ સમસ્યાઓનું સમાધાન મળી ચુક્યું છે. તમારું જીવન ધન્ય બની ગયું છે.

જે સાધક સાધનાને વધુ ને વધુ સમર્પિત બનશો, તેને અહીં કહેલ શુભ પરિણામો વધુ ને વધુ સ્પષ્ટપણો અનુભવશો.



તરાક્ષિક શિરોમળિંગ સંવિજન ગીતર્થ પરમ પૂજય  
આચાર્યદીપ શ્રીમદ્બ્રહ્મજ્ય જ્યસુંદરસ્ફુરીશ્વરજી  
મહારાજનો પ્રતિભાવ

પ.પૂ આચાર્યદીપ વૈરાગ્યદેશનાદક્ષ હેમચન્દ્રસ્ફુરિંગ મ.સા.ની  
સેવામાં સાદર વન્દનાવતિ.

આપશ્રીએ અનુભવવા માટે આપેલ આ આત્મૈષાણ પ્રક્રિયાનો  
લેખ અનુભવી લીધો છે. ખૂબ સારો આ પ્રયોગ અનેક અન્તર્મુખી  
સાધકોને આત્મતત્ત્વદર્શિનમાં પ્રેરક માર્ગદર્શક બનશે - એટલો ભારે  
સુંદર છે. લેખકને ધન્યવાદ !

કામ સેવા ફરમાવશો.

લિ.

જ્યસુંદરસ્ફુરિની વન્દનાવતિ.

પૂજ્યપાદશ્રીએ અમૂલ્ય સમય ફાળવીને કરી આપેલ  
મહત્ત્વપૂર્ણ સંશોધન અને સૂચનો માટે  
તેઓશ્રીનો ખૂબ ખૂબ ઉપકાર.